

**રાઈટોજીઅસ રીપબ્લીક** : ઘ પોલિટિકલ ફાઉન્ડેશન્સ ઓફ મોર્ડન ઈન્ડિયા (2012)ના રાઈટર અનન્યા વાજપાઈએ આઈઆઈટી-જીના વિદ્યાર્થીઓ સાથે 'ઈમેજિંગ ઈન્ડિયા' પર ઈન્ટરેક્ટ કર્યું.

# ઈન્ડિયન પોલિટિક્સના ગેલિલિયો છે ગાંધીજી



## LECTURE @ IIT

સિટી રિપોર્ટર • 'ગાંધીજી મોર્ડન ઈન્ડિયન પોલિટિક્સના ગેલિલિયો હતા. તેમના વિચારો અને તેમની મુવમેન્ટના લીધે ઈન્ડિયન પોલિટિક્સને નવી દિશા મળી.' આ શબ્દો છે રાઈટોજીઅસ રીપબ્લીક : ઘ પોલિટિકલ ફાઉન્ડેશન્સ ઓફ મોર્ડન ઈન્ડિયા (2012)ના રાઈટર અનન્યા વાજપાઈના. આઈઆઈટી-ગાંધીનગર ખાતે અનન્યા વાજપાઈએ વિદ્યાર્થીઓ સાથે 'અ કન્ટ્રી આર ઓન : ઈમેજિંગ ઈન્ડિયા, 1915-2015' પર ટોક કરી હતી.



અનન્યા વાજપાઈ

### નવા પોલિટિકલ

### આઈડિયાની તાતી જરૂર

આઈઆઈટી- ગાંધીનગરના સ્ટુડન્ટ્સ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 'ગાંધી, નેહરૂ અને આંબડકરના વિચારોથી ભારતે લોકશાહી મેળવી છે. પણ હવે યુથે દેશને એમ્પાવર કરવા માટે નવા પોલિટિકલ આઈડિયાની સાથે આવવું જોઈએ.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભારતે ડીપ કાઈસીસનો સામનો કર્યો છે. મુઘ, ગુપ્ત, અશોકા, બુદ્ધ આ બધા આપણે ત્યાં થઈ ચૂક્યા છે, તેમ છતાં બ્રિટન જેવો નાનો દેશ આપણાં પણ રાજ કરી ગયો છે. આપણે આપણી ભાષા, કલ્ચર ભૂલી ગયા છીએ. નવી બિલ્ડિંગ બનવી, ફ્લાયઓવર થવા, વાઈ-ફાઈ કનેક્ટિવિટી મળવી તે ઈમેજનરી નથી. પણ ગાંધી અને ટાગોર નવા જન્માવા, તેવી શક્યતાઓ ઉભી

કરવી, નવો સંવાદ, કલ્ચર, ભાષા તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે.' અંતમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું યંગ ઓડિયન્સને એટલું જ કહેવા માગીશ કે ભારતીય લોકશાહીમાં આજના સમયમાં થતાં ડેવલપમેન્ટ અને યોગદાનમાં તેમણે પોતાની ઈમેજનેશન્સને ચેલેન્જ કરવીજોઈએ'

### દરેક મૂવમેન્ટમાં ગાંધી

હિન્દુ નેશનાલિઝમ પર વાત કરતાં વાજપાઈએ જણાવ્યું હતું કે, 'હિન્દુ નેશનલાઝિમ એ હંમેશાંથી ભારતીય સ્વતંત્રતા મૂવમેન્ટમાં આગળ રહ્યું છે. તેની પાછળ પણ ગાંધી આઈડિયાની છુપાયેલો છે. નેહરુ અને ટાગોર એ ઓલ્ટરનેટીવ હતા. ટાગોર પોલિટિશિયન ન હતા, તેઓ સ્વદેશી મુવમેન્ટ સાથે બંગાળમાં જોડાયેલા હતા. બાકી તો જમીન, નદી, ડેમ, રાયટ્સ, આ દરેક મૂવમેન્ટ પાછળ ગાંધીજી છે.